

RAN-2508000605020002

T.Y.B.Com. (Sem. V) Examination March - 2026
Indian Banking And Currency : (Paper -V) Major

Time: 2 Hours]**[Total Marks: 50**

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book.	Seat No.: <table border="1"> <tr> <td> </td> <td> </td> <td> </td> <td> </td> <td> </td> <td> </td> </tr> </table> Student's Signature						

- પ્ર.1. નીચેના પ્રશ્નોનાં ટૂંકમાં જવાબ આપો (કોઈપણ પાંચ) (Any Five) 10**
- બેંક એટલે શું?
What is a bank?
 - ભારતમાં કેટલી જાહેરાત ક્ષેત્રની બેંકો છે?
How many public sector banks are there in India?
 - વિદેશી વેપાર માટે બેંકો કઈ રીતે મદદરૂપ બને છે.
How do banks help in foreign trade?
 - ખાનગીક્ષેત્રની બેંકના કોઈપણ ચાર નામ આપો.
Give any four names of private sector banks.
 - મર્ચન્ટ બેંકિંગના હેતુઓ જણાવો.
State the objectives of merchant banking.
 - સેબીનું પુરું નામ લખો.
Write the full name of SEBI.
 - ચોખ્ખી મિલકત એટલે શું?
What is net worth?
- પ્ર.2. જાહેરાત ક્ષેત્રની બેંકો અને ખાનગી ક્ષેત્રની બેંકોના ફાયદાઓ અને મર્યાદાઓ સમજાવો. 14**
Explain the advantages and limitations of public sector banks and private sector banks.
- અથવા**
- પ્ર.2. (અ) ભારતીય બેંકિંગ પદ્ધતિનું માળખું સમજાવો. 07**
(બ) થાપણ વીમા યોજનાનું મહત્વ સમજાવો. 07
- (a) Explain the structure of the Indian banking system.**
(b) Explain the importance of deposit insurance scheme.
- પ્ર.3. મર્ચન્ટ બેંકિંગનો અર્થ જણાવી, તેની ભૂમિકા સમજાવો. 14**
Explain the meaning of merchant banking. Explain its role.
- અથવા**

પ્ર.3. (અ)	મ્યુચ્યુઅલ ફંડનો વિકાસ સમજાવો.	07
(બ)	મનીમાર્કેટ મ્યુચ્યુઅલ ફંડ સમજાવો.	07
(a)	Explain the development of mutual funds.	
(b)	Explain money market mutual funds.	
પ્ર.4.	ટૂંકનોંધ લખો (ગમે તે ત્રણ) (Short Note) (Any Three)	12
1.	મર્ચન્ટ બેંકિંગનો ખ્યાલ The concept of merchant banking	
2.	સેબીની માર્ગદર્શિકાઓ SEBI guidelines	
3.	થાપણ વીમા યોજનાની લાક્ષણિકતાઓ Features of Deposit Insurance Scheme	
4.	મર્ચન્ટ બેંકિંગનો ખ્યાલ The concept of merchant banking	
5.	બહુરાષ્ટ્રીય બેંકો Multinational banks	